

RAN-1901130702020001
M.A. Economics (Sem.- II) Examination March - 2026
Macro Economics - II-CC - 05
Time: 2 Hours]
[Total Marks: 50

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book. (2) જમણી બાજુ દર્શાવેલ અંક પ્રશ્નોના ગુણ દર્શાવે છે. The number on the right shows the marks of the questions.	Seat No.: Student's Signature
---	--

- પ્ર. 1 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. (10)**
- વપરાશ વિધેય એટલે શું?
 - કોબ-વેબ સિદ્ધાંતની ધારણાઓ જણાવો.
 - LM વક્રના લક્ષણો જણાવો.
 - પ્રો.જે.બી સેનો પુરવઠા અંગે ખ્યાલ જણાવો.
 - સ્વાયત મૂડીરોકાણ એટલે શું?
- પ્ર. 2 કાયમી આવક એટલે શું? મિલ્ટન ફ્રીડમેનના કાયમી આવકના સિદ્ધાંતની વિસ્તારથી ચર્ચા કરો. (13)**
- અથવા**
- પ્ર. 2 વેપારચક્ર એટલે શું? વેપારચક્રના તબક્કા જણાવી, તેને નિયંત્રણ કરવા માટેના પગલાઓની સવિસ્તાર ચર્ચા કરો. (13)**
- પ્ર. 3 AD/AS મોડેલમાં નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિની અસરકારતા વિસ્તારથી જણાવો. (13)**
- અથવા**
- પ્ર. 3 નાણાંવાદી અને કેઈન્સવાદીનો અર્થ જણાવી. કેઈન્સવાદી વિચારધારાની વિસ્તૃત ચર્ચા કરો. (13)**
- પ્ર. 4 ટૂંક નોંધ લખો. (કોઈ પણ બે) (14)**
- મૂડીની સિમાંત કાર્યક્ષમતાને અસર કરતાં પરિબળો
 - હાયકનો વેપારચક્રનો સિદ્ધાંત
 - IS/LM મોડેલ
 - તાર્કિક અપેક્ષાનો સિદ્ધાંત

ENGLISH VERSION

- Q. 1 Write short Question (10)**
1. What is the consumption function?
 2. State the assumptions of cob-web theory.
 3. State the characteristics of LM curve.
 4. Explain the concept regarding the supply of Prof. J.B. Say.
 5. What is Autonomous Investment?
- Q. 2 What is permanent income? Discuss Milton Friedman's theory of permanent income in detail. (13)**
- OR**
- Q. 2 What is a business cycle? State the stages of business cycle, discuss in detail the steps to control it. (13)**
- Q. 3 Explain the effectiveness of monetary policy and fiscal policy in AD/AS model. (13)**
- OR**
- Q. 3 Explain the meaning of Monetarist and Keynesian. Discuss Keynesian ideology in detail. (13)**
- Q. 4 Write a Short Note (any two) (14)**
1. Factors Affecting Marginal Efficiency of Capital.
 2. Hayek's theory of the business cycle.
 3. IS/LM model.
 4. Principle of rational expectation.
-